

અરજી ભરવા માટેના સૂચનો

સીસીસી રજીસ્ટ્રેશન ફોર્મ ભરવાની શરૂઆત કરતાં પહેલા નીચે મુજબની વસ્તુઓ તૈયાર હોવી જોઈએ:

- સરકારી કામગીરીમાં જોડાયાની તારીખ
- વિભાગમાં જોડાયાની તારીખ
- નિવૃત્તિની તારીખ
- સ્કેન કરેલો પાસપોર્ટ સાઈઝનો ફોટોગ્રાફ (૨૦૦ KB થી વધારે નહીં)
- સ્કેન કરેલ હસ્તાક્ષર (૨૦૦ KB થી વધારે નહીં)

1. નવા રજીસ્ટ્રેશન માટે “Click here for **New Application**” હાયપરલિંક પર ક્લિક કરો.
2. જો તમારી પાસે એપ્લિકેશન નંબર હોય તો, તમારો મોબાઇલ નંબર અને રજીસ્ટ્રેશન નંબર દાખલ કરીને તમારી માહિતી જોઈ તેમજ તેમાં ફેરફાર કરી શકો છો.
3. ફોર્મમાં બધી માહિતી ભરો અને “Submit” બટન ક્લિક કરો.
4. “Submit” બટન પર ક્લિક કરતાં પહેલા તમે તમારો પાસપોર્ટ સાઈઝનો ફોટોગ્રાફ અને સ્કેન કરેલ હસ્તાક્ષર અપલોડ કરો.
5. તમારો ફોટો, હસ્તાક્ષર, એપ્લિકેશન નંબર અને અન્ય અંગત વિગતો તપાસો. જો કોઈ ફેરફાર હોય તો, “Edit” બટન પર ક્લિક કરો.
6. જરૂરી ફેરફારો કરો અને પછી “Submit” બટન પર ક્લિક કરો.
7. ફરી એકવાર, તમે ફોર્મને ફક્ત વાંચી શકો તે સ્વરૂપે રજુ થશે.
8. જો બધી માહિતી સાચી છે તો, “Lock & Print” બટન પર ક્લિક કરો. નોંધ: એકવાર “Lock & Print” બટન ક્લિક કર્યા બાદ માહિતીમાં કોઈ ફેરફાર થઈ શકશે નહીં.
9. ભરેલ ફોર્મને પ્રિન્ટ કરવા માટે “Print” બટન પર ક્લિક કરો.
10. ફોર્મને પ્રિન્ટ કર્યા બાદ ચલણ માટે “Continue” બટન પર ક્લિક કરો.
11. પરીક્ષાનો પ્રકાર પસંદ કરો જેમકે Theory & Practical, Only Theory અને Only Practical અને “Generate Challan” બટન પર ક્લિક કરો.
12. તમારી પાસે ફી ચૂકવવા માટેના બે વિકલ્પ આવશે એક ઓનલાઇન(ક્રેડિટ / ડેબિટ કાર્ડ / નેટ બેન્કિંગ) અને બીજું ઓફલાઇન(ડિમાન્ડ ડ્રાફ્ટ / રોકડ).
13. જો તમે ઓનલાઇન ચૂકવણી કરવાનું પસંદ કરો છો, તો પ્રક્રિયા અનુસરો અને અંતે રિસીટ પ્રિન્ટ કરો. જો તમે ઓફલાઇન ચૂકવણી કરવાનું પસંદ કરો છો, તો HDFC બેંકની ડીપોઝીટ સ્લીપ પ્રિન્ટ કરો અને જરૂરી માહિતી ભરો. ડ્રાફ્ટ Registrar, IITRAM (Payable at Ahmedabad) ની તરફેણમાં તૈયાર કરવો.

14. ડીપોઝીટ સ્લીપની Office Copy અને ડ્રાફ્ટ(જો ચુકવણી ડીડી દ્વારા કરવામાં આવે છે) અથવા જો ચુકવણી ઓનલાઇન કરવામાં આવેલ હોય તો તેની રીસીટની પ્રિન્ટ સાથે નીચે મુજબના ડોક્યુમેન્ટ જોડી મોકલી આપો:

**Institute of Infrastructure Technology Research And Management (IITRAM)
Near Khokhra Circle (East),
Ahmedabad – 380026, Gujarat**

બિડાણ માટેના દસ્તાવેજો:

- સિક્કો અને સંસ્થાના વડાની સહી સાથે ભરેલ અરજી ફોર્મ
- ફી ભર્યાની રીસીટ
- તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો રંગીન ફોટોગ્રાફ
- નિમણૂક પત્ર
- જોડાયા પત્ર (તાજેતરની સંસ્થાનો)
- અગાઉ આપેલ સીસીસી પરીક્ષાનું પરિણામ (જો કોઈ હોય તો)
- સંસ્થા / ઓફિસ નું આઈડી પૂરું
- ફોટો આઈડી પૂરું (મતદાર કાર્ડ/ડ્રાઇવિંગ લાયસન્સ/પાન કાર્ડ/પાસપોર્ટ/આધાર કાર્ડ)
- સરનામાંનું પૂરું (મતદાર કાર્ડ/ડ્રાઇવિંગ લાયસન્સ/પાન કાર્ડ/પાસપોર્ટ/આધાર કાર્ડ/ફોન બિલ)

અરજદારે તેમની અરજી IITRAM ને વ્યક્તિગત અથવા તો પોસ્ટ દ્વારા મોકલી આપવાની રહેશે.

15. અરજદારે યોગ્ય માહિતી ભરવી જેથી હોલ ટીકીટ યોગ્ય રીતે ફાળવી શકાય.
16. અરજદારે Theory & Practical માટે ₹ 200 ફી અથવા માત્ર Theory માટે ₹ 100 અથવા માત્ર પ્રેક્ટિકલ માટે ₹ 100 ચુકવવાના રહેશે. ચુકવણી ઓનલાઇન અથવા ઓફ ઓફલાઇન થઈ શકશે. ઓફલાઇનના કિસ્સામાં, ચુકવણી રોકડમાં અથવા તો ડિમાન્ડ ડ્રાફ્ટ(ડીડી) મારફતે કરી શકાશે. ડીડી **Registrar, IITRAM** (Payable at Ahmedabad) ની તરફેણમાં હોવો જોઈએ.
17. અપૂર્ણ ફોર્મસ IITRAM દ્વારા સ્વીકારવામાં આવશે નહીં
18. કોઈપણ ટપાલ વિલંબ માટે IITRAM જવાબદાર નથી.
19. પરબીડિયા પર સૌથી ઉપર “**CCC Exam Form : તમારો રજીસ્ટ્રેશન નંબર**” લખવો.
દા.ત. “**CCC Exam Form : IITCCC160600001**”
20. જો ફોટો દેખાતો ન હોય, તો ફોર્મમાં ફોટો ચોટાડો અને સ્કેન કરેલ ફોટો રજીસ્ટ્રેશન નંબર સાથે ccc@iitram.ac.in પર મેઈલ કરી આપો. જો ફોટો દેખાતો હોય તો ફોટો બદલવાની જરૂર નથી.
21. અરજીપત્રકને લગતાં પ્રશ્નો/સમસ્યાઓ ccc@iitram.ac.in પર મેઈલ કરી આપો.
22. સીસીસી પ્રવેશ માટેના બધા અધિકાર IITRAM દ્વારા આરક્ષિત છે.